

દર મહિનાની ૧૫મી તારીખે પ્રસિદ્ધ થતું માસિક
શ્રી ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત

ભટ્ટમેવાડા વર્તમાન

વેબસાઈટ : www.Bhattmewada.org

તંત્રી : બિપીનચંદ્ર જોષી

Gandhinagar

RNI NO. GUJGUJ/2008/28227
Post:L-2/RNP/G-GNR-266/09-11
Sector-07 Post, Gandhinagar
Valid Up to : 31 Dec. 2011
Rs. 5-00, Annual : Rs. 50-00

● વર્ષ : ૧ ● અંક : ૮ ● તા. ૧૫-૦૫-૨૦૧૧ ● પાના : ૮ ● છૂટક કિંમત - રૂ. ૫/- ● વાર્ષિક લવાજમ - રૂ. ૫૦/-

રજિ. કાર્યાલય : પ્લોટ નં. ૫૧૭/૧, વાસ્તુનિર્માણ સોસાયટી, સેક્ટર-૨૧, ગાંધીનગર. ● મો. 98982 54550

સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણે સંસ્થાનું કામ સારામાં સારી રીતે ચાલે એ રીતે વર્તવાની આપણી ફરજ છે - વિનોબા ભાવે

આપણી વૃત્તિ-સન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈ પણ એક ચોક્કસ નક્કી કરેલી ભૂમિકા પરથી ચાલવો જોઈએ. તે મર્યાદામાં રહીને, તે એક ચોક્કસ કરેલી નિયમિત રીતથી આપણું જીવન ચાલે તો જ મન મોકળું રહી શકે. નદી છૂટથી, મોકળાશથી વહે છે પણ તેનો -વાહ બંધાયેલો છે. બંધાયેલો ન હોય તો તે મોકળાશપણું, તેની સ્વતંત્રતા એળે જાય. ઠરાવેલ ચોક્કસ રસ્તે ફરવા જવાની આપણને ટેવ પડી

હોય તો રસ્તા તરફ ધ્યાન ન આપવા છતાં મનમાં વિચાર કરતાં કરતાં આપણે ફરી શકીએ છીએ, એ આપણા અનુભવની વાત છે. ફરવાને માટે રોજ નવો રસ્તો લઈએ તો બધું ધ્યાન તે રસ્તા તરફ રોકવું પડે છે. મનને પછી છૂટ રહેતી નથી. સારાંશ, જીવન બોજારૂપ ન લાગતાં જીવનમાં આનંદ લાગે તેટલા સારુ આપણે આપણા વહેવારને બાંધી લેવો જોઈએ.

આપણે જન્મીએ છીએ ત્યારે ત્રણ સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ. એ ત્રણ સંસ્થા કઈ ? આપણી આજુબાજુ વીટળાયેલું

શરીર એ એક સંસ્થા; આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ, જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા; અને જે સમાજમાં આપણે જન્મ્યા તે સમાજ; આપણા જન્મની વાટ જોઈ રહેલાં આપણાં માબાપ, આપણાં ભાઈબહેન, આપણી આસપાસના આપણા આડોશી-પાડોશી એ ત્રીજી સંસ્થા છે. આ ત્રણે સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત -ચત્ત કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય -ાજ્ઞ થયું છે તે આપણે અદા કરવું જોઈએ.

આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી ? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો આપણા પરિચયના હોવા છતાં, તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણે વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણે સંસ્થા સાર્યક થાય અને આપણું જીવન પણ -સન્ન તેમજ મોકળું રહે.

આ અર્થ સમજવાને સારું પહેલાં યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ સંસ્થાને આપણે રોજ

વાપરીએ છીએ. સો માણસો એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા ગંદી કરી નાખીએ છીએ. અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સૃષ્ટિ-સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ-સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શું છે ? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વરસથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ. એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, 'પૃથ્વીનો કસ તેને પાછો મેળવી આપ. તેમાં ખેડ કર, સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર.' પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધિકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે. પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાઢવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી એ વાતોની સાથે -ત્પક્ષ કંઈક (અનુ. પાન નં. ૪ પર)



શ્રી ભટ્ટમેવાડા બ્રહ્મ સમાજ, ગાંધીનગરના અગ્રણી અને ભટ્ટમેવાડા વર્તમાનના તંત્રી શ્રી બિપીનચંદ્ર ચંદુલાલ જોષીના સુપુત્ર ચિ. ચિંતનના લગ્ન ચિ. અમી સાથે તા. ૬.૫.૨૦૧૧ ના રોજ યોજાઈ ગયાં. નવદંપત્તિ પર સુખી, સમૃદ્ધ અને ેમમય દાંમ્પત્યજીવન માટે પુજ્ય એકલીગજી દાદાની કૃપા રહે તેવી શુભેચ્છા.

હાય હેલ્લો છોડો... જય એકલિંગજી બોલો...

તંત્રી સ્થાનેથી....

સલાહ નહિ સહાય.....

માનવતા એ છે કે, બીજાના દુઃખને કદી નાનું ન સમજાવે. માનવધર્મ એ છે કે, બીજાની આફતની ક્ષણે માત્ર શબ્દોથી આશ્વાસન આપવાને બદલે એને નકકરરૂપે મદદરૂપ થઈએ. ઉપદેશ દેનારા લોકોનો તો તોટો જ ક્યાં છે ? સલાહ કરતાં સહાય મહત્વની છે. ઉપદેશ કરતાં ઉદાહરણ ચઢિયાતું છે. બીજાના દુઃખને પોતાનું સમજવું અને પોતાના સુખમાં સૌને સહભાગી કરવાં. આટલું જો આવડી જાય તો પછી મંદિર-દેરાસરના ચકકર કાપવાની જરૂર નથી અને જો એ ન આવડે તો પછી મંદિરના ફોગટ ફેરા ફરવાનો કશો અર્થ નથી.

સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે, ખરી સેવા એ માનવ સેવા છે. જો કોઈ દુઃખી, ગરીબ અને માંદા માણસને મદદ કરી હશે તો તે ઈશ્વરની -ર્થના જેટલું જ ફળ આપે છે.

આપણે સૌ ભટ્ટમેવાડા બ્રાહ્મણો રાજસ્થાનમાંથી સ્થળાંતર કરીને ગુજરાત અને અન્ય નંતોમાં વસ્યા છીએ. અન્ય જ્ઞાતિઓની સરખામણીએ આપણું સંખ્યાબળ ખૂબ જ ઓછું, નગણ્ય છે. આપણે જયારે ઓછી સંખ્યામાં છીએ ત્યારે આપણને બહારનું કોઈ મદદ કરશે, આપણા ઉત્કર્ષમાં અન્ય કોઈ આગળ આવશે તેમ માનવું ભુલભરેલું ગણાશે.

તેથી આપણે જ્ઞાતિબંધનોએ એકબીજાને મદદ કરવાની છે. બીજા અર્થમાં જોઈએ એ તો આપણે અન્ય જ્ઞાતિજનને કરેલી મદદ, જ્ઞાતિજન તરફ લંબાવેલો હાથ બીજા અર્થમાં પોતાની મદદ માટે લંબાવેલો હાથ છે. આગળ જણાવ્યું તેમ સલાહ નહિ સહાય અગત્યની બાબત છે અને પરિણામ સહાયનું જ આવે છે.

ષષ્ઠમ સંમેલનમાં નકકી થયા મુજબ સમાજ તરફથી જ્ઞાતિજનો માટે મૃત્યુ સહાય અને બિમારી સહાયની યોજના જાહેર કરવામાં આવેલ છે. આ બંને યોજનાઓ ખૂબ જ સરસ છે. એલઆઈસી કે અન્ય વિમા એજન્સીઓના વિમાની યોજનાઓ કરતાં ખૂબ જ સસ્તી છે અને તેની સાથોસાથ યોજનાનો ઉમદા હેતુ- જ્ઞાતિજનને સહાયનો છે. આપણે બીજી રીતે સહાય માટે હાથ ન લંબાવી શકીએ તો આ યોજનાઓમાં સભ્ય પદ વહેલામાં વહેલીતકે મેળવીને અન્યને અને ખુદને સહાય કરીએ.

- તંત્રી

વેદ પ્રાર્થના

સક્તુમિવ તિતુના પુનન્તો યત્ર ધીરા મનસા વાચમકૃત ।
અત્રા સઘાયઃ સઘ્યાનિ જાનતે ભદ્રે ષાં લક્ષ્મીર્નિહિતાધિ વાચિ ॥

- ઋગ્વેદ ૧૦-૭૧-૨

જેમ ચાળણીમાં ચાળીને સત્તુને સાફ કરવામાં આવે છે. તેવી રીતે જે વિષયમાં બુદ્ધિમાન લોકો જ્ઞાનરૂપી ચાળણી દ્વારા વાણીને શુદ્ધ કરીને ઉપયોગ કરે છે ત્યાં હિતેષી વિદ્વાન લોકો હિતની વાતોને સમજે છે. તેની વાણીમાં કલ્યાણકારક લક્ષ્મી રહે છે.

મૌ

વિશ્વની શક્તિનો સરવાળો એટલે.....મૌ
સ્નેહની વહેતી સરીતા એટલે.....મૌ
પ્રેમની અખંડીત પ્રતિમા એટલે.....મૌ
સંસ્કારોની જુલતા ઝોળી એટલે.....મૌ
મમતાની અતુ સારંગી એટલે.....મૌ
દૈત્યને દેવ બનાવવાની શક્તિ એટલે.....મૌ
ચારિત્ર્યનું ઘડતર કરનાર એટલે.....મૌ
વાણીમાં મધુરતા ભરનાર એટલે.....મૌ
જ્ઞાનનો ભયો ભંડાર એટલે.....મૌ
પ્રસુતાની વેદના સહેનાર એટલે.....મૌ
દયાની દેવી એટલે.....મૌ
દુનિયાની જોડમાં અજોડ એટલે.....મૌ

Kirit Upadhyay
M. 98256 55405

Jaimin Upadhyay
M. 96628 30607



fruits/platters/juices

2, Yogi Complex, Opp. Axis Bank,
Nr. Drive-in-Cinema, Ahmedabad-54.
Ph. : 079-30221144

તમારી ચરબી તમે માપો

- કાન્તિભાઈ રા. પટેલ
નિવૃત્ત મુખ્ય રમતગમત અધિકારી

શરીરની ચરબી વધી છે કે નહીં તેની અટકળ સામાન્ય રીતે આપણા પેટના ઘેરાવા ઉપરથી કરતા હોઈએ છીએ. આ અટકળ અંશિક રીતે સાચી છે. પરંતુ ચરબી તો સમગ્ર શરીરમાં વત્તે ઓછો અંશે સંગ્રહાયેલી હોય છે. તો ચરબીના આ પ્રમાણને કેવી રીતે શોધવી ? આ એક મુશ્કેલ પ્રશ્ન છે.

શરીરની ચરબીનો સીધેસીધો સંબંધ આપણી ચામડી નીચે સંગ્રહાયેલ ચરબીના જથ્થા સાથે રહેલો છે. પરંતુ ચામડી તો સમગ્ર શરીર ઉપર બધે જ વ્યાપેલી છે. વળી શરીરની ચરબીનો, શરીરના વજન સાથે કોઈ સંબંધ ખરો ? હા, આ પ્રકારનો સંબંધ શોધવા માટે ક્યુરેલેટ નામના એક વૈજ્ઞાનિકે એક જથ્થાદર્શક સૂત્ર શોધી કાઢેલ છે. જે નીચે મુજબ છે.

$$\text{શરીર જથ્થા દર્શક (Body Mass Index)} = \frac{\text{વજન (કિ.ગ્રા)}}{(\text{ઊંચાઈ મીટર})^2}$$

આ સૂત્ર મુજબ દરેક વ્યક્તિએ પહેલાં પોતાનું વજન કિ.ગ્રામમાં કરવાનું રહે તથા સાથે પોતાની ઊંચાઈ પણ મીટરમાં માપવાની રહે. દા.ત. એક વ્યક્તિનું વનજ ૬૫ કિ.ગ્રા. છે અને તેની ઊંચાઈ ૧.૭૧ મીટર એટલે ૧.૭૧ સે.મી. છે. તો તેનો BMI કેટલો આવે ? હવે આ માપ આપણે સૂત્રમાં મૂકીને ગણતરી કરીશું.

$$\begin{aligned} \text{BMI} &= \frac{\text{Wt. Kg.}}{(\text{Height. metre})^2} \\ &= \frac{65}{(1.71)^2} \\ &= \frac{65}{1.71 \times 1.71} \\ &= \frac{65}{2.92} \\ &= 22.26 \text{ આવશે.} \end{aligned}$$

નોંધ : જો વજન ફૂટ અને ઈંચમાં હોય તો ૧ ઈંચ = ૨.૫૦ સે.મી. પ્રમાણે ગણતરી કરીને કુલ ઊંચાઈ શોધી કાઢવી. દા.ત. ૫ ફૂટની ઊંચાઈ હોય તો તેના ઈંચ ૬૦ થાય. તેથી ૬૦ ટ ૨.૫૦ = ૧૫૦ સે.મી. અથવા ૧.૫૦ મીટર થાય.

આ BMI નો સીધો સંબંધ આપણા વજન સાથે રહેલ છે. તો આવેલ BMIને ધ્યાનમાં લેતાં વજન ઓછું, યોગ્ય, વધારે અને ઘણું વધારે (મેદસ્વીતા) છે કે કેમ, તે માટે પણ વૈજ્ઞાનિક ક્યુરેલેટે માપ આપેલ છે, જે નીચે પ્રમાણે છે.

- (૧) BMI ૧૮.૫ કરતાં ઓછો હોય તો વજન ઓછું ગણાય.
- (૨) BMI ૧૮.૫ થી ૨૪.૯ હોય તો વજન યોગ્ય ગણાય.
- (૩) BMI ૨૫.૦ થી ૨૯.૯ હોય તો વજન યોગ્ય ગણાય.
- (૪) BMI ૩૦.૫ થી વધારે હોય તો મેદસ્વીતા એટલે કે શરીરમાં ચરબીનું પ્રમાણ ઘણું વધારે જે તેવું ગણાય. જો કે બાળકો, કિશોરો અને યુવાનોમાં સામાન્ય રીતે ચરબી

લેખક પરિચય

નામ : કાન્તિભાઈ રા. પટેલ

જન્મ તારીખ : ૫ એપ્રિલ, ૧૯૩૫

શૈક્ષણિક લાયકાત : - બી.એસ.સી., ડી.પી. એડ્, એમ.એડ્

શ્રી કાન્તિભાઈ પટેલ ૧૫ વર્ષથી પણ વધારે સમયનો શૈક્ષણિક અનુભવ ધરાવે છે, આ ઉપરાંત નિયામક, રમતગમત અધિકારી અને સચિવ જેવા મહત્વના હોદ્દાઓને શોભાવતા શ્રી કાન્તિભાઈ પટેલ ૨૫ વર્ષના વહીવટી અનુભવનું ભાથું પણ ધરાવે છે. અનેક રમતોમાં રમત સિદ્ધિઓ હાંસલ કરેલ છે જેમાં કબડ્ડી, બાસ્કેટ બોલમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ છે. આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ - કોન્ફરન્સમાં જોડાયા છે વળી અખિલ ભારતીય શાળાકીય રમત મહામંડળમાં પ્રતિનિધિત્વ શોભાવ્યું છે.

રમતગમત ક્ષેત્રે વિવિધ વિષયો અને સંશોધન બાબતે લેખોની સાથે અને પુસ્તકોનું લેખનકાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.

હોવાનો પ્રશ્ન હોતો નથી. પરંતુ જેમણે ૪૦ થી ૫૦ વર્ષ વિતાવ્યાં હોય તેવી વ્યક્તિઓમાં વધારે ચરબી હોવાની શક્યતા છે. આ ચરબી આપણા શરીરના સ્નાયુઓ ઉપર અને આપણા શરીરની ચામડી નીચે જામેલી હોય છે. સ્નાયુઓ આપણા શરીરના હાડકાં ઉપર હોય છે.

સમાજની દરેક વ્યસ્ક વ્યક્તિ પોતાનો BMI પોતે શોધી શકે છે. આ માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

- (૧) વજન અને ઊંચાઈ માપ્યાની તારીખ નોંધી લેવી.
- (૨) ફરીથી એક મહિના પછી તે જ તારીખે (અનુ. પાન નં. ૫ પર)



LIC

ભારતીય જીવન ડીમા નિગમ
LIFE INSURANCE CORPORATION OF INDIA

Paresh C. Joshi

INVESTMENT CONSULTANT

General Insurance
Life Insurance Corporation of India

Plot No. 572/1, Sector-6 B,
Gandhinagar-382 006.

Mobile : 96381 48699

Phone : 079 - 23236704

સૃષ્ટિ, સમાજ....(પાન ૧નું શેષ)
નિર્માણ કરવું, એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતી તે પેદા કરવાનું છે. કપાસ પકવવો, અનાજ પેદા કરવું, સૂતર કાંતવું, એ બધી પણ યજ્ઞક્રિયાઓ જ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડ્યો, તે ભરી કાઢવાની કર્તવ્યભાવના એમાં હોવી જોઈએ. આ કંઈ પરોપકાર નથી. આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારુ જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિતિ કરવાની છે તે યજ્ઞ એટલે સેવા છે, પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ-સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારુ અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો છે.

બીજી સંસ્થા માણસનો સમાજ છે. માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો -યોગ તે દાન છે. દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દૂબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે, કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતાં તેની હું જે સેવા કરું તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના આ ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્યસમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી, ધનથી અથવા બીજા સાધનથી કરેલી મદદ તે દાન છે.

આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે. તે આ શરીર. શરીર પણ રોજરોજ ઘસાય છે. આપણે મન, બુદ્ધિ, ઈન્દ્રિય એ બધાંને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કક્ષું છે.

આમ સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ સંસ્થાનું કામ સારામાં સારી રીતે ચાલે એ રીતે વર્તવાની આપણી ફરજ છે. આપણે યોગ્ય અથવા અયોગ્ય અનેક સંસ્થાઓ ઊભી કરીએ છીએ. પણ આ ત્રણ સંસ્થા આપણી ઊભી કરેલી નથી. તે સ્વભાવતઃ આપણને આવી મળી છે. એ સંસ્થાઓ કૃત્રિમ નથી. એવી એ ત્રણ સંસ્થાઓને લાગેલો ઘસારો યજ્ઞ, દાન અને તપ એ સાધન વડે ભરી કાઢવાનો મારો સ્વભાવ-જ્ઞ ધર્મ છે. આ -માણે આપણે વર્તવું હોય તો આપણી જે હશે તે બધીયે શક્તિની એમાં જરૂર પડશે. બીજી વાતો કરવાની વધારાની શક્તિ આપણી પાસે ફાજલ નહીં રહે. આ ત્રણ સંસ્થા સુંદર રીતે ચાલે તેટલા ખાતર આપણી બધીયે શક્તિ વાપરવી પડશે. કબીરની માફક આપણે પણ જો કહી શકીએ કે ‘હે ઈશ્વર ! તેં મને જે ચાદર આપી હતી તે જેવી ને તેવી પાછી આપી, આ હું ચાલ્યો. એ તારી ચાદર બરાબર તપાસી લે.’ તો કેવડી મોટી સફળતા ગણાય ! પણ એવી સફળતા મળે તે માટે યજ્ઞ, દાન અને તપનો ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.

યજ્ઞ, દાન અને તપ એ ત્રણેમાં આપણે ભેદ જોયો, પણ ખરું જોતાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ તદ્દન જુદી સંસ્થાઓ નથી. આ સમાજ સૃષ્ટિની બહાર નથી. આ શરીર પણ સૃષ્ટિની બહાર નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ-સંસ્થા બને છે. તેથી જે ઉત્પાદક શ્રમ કરવાનો છે, જે દાન કરવાનું છે અને જે તપ આચરવાનું છે તે

બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાશે. આ ત્રણે સંસ્થાને માટે જે જે સેવા આપણે કરીશું તે સેવા યજ્ઞરૂપ જ હશે. માત્ર એ સેવા નિરપેક્ષ હોય એટલે થયું. આ સેવામાં ફળની અપેક્ષા રાખી શકશે જ નહીં. કેમકે ફળ આપણે આગળથી લઈ લીધેલું છે. પહેલાંનું દેવું માથે છે. જે લીધું છે તે પાછું આપવાનું છે. યજ્ઞથી સૃષ્ટિ-સંસ્થામાં સામ્યાવસ્થા -જ્ઞ થાય છે, દાનથી સમાજમાં સામ્યાવસ્થા -જ્ઞ થાય છે અને તપથી શરીરમાં સામ્યાવસ્થા રહે છે. આમ, આ ત્રણે સંસ્થાઓમાં સામ્યાવસ્થા રાખવાને માટેનો આ કાર્યક્રમ છે. એથી શુદ્ધિ થશે, દૂષિત ભાવ નીકળી જાય છે.

આ જે સેવા કરવાની છે તે માટે કંઈક ભોગ પણ લેવો પડશે. ભોગ એ પણ યજ્ઞનું જ એક અંગ છે. આ ભોગને ‘આહાર કક્ષો’ છે. આ શરીરરૂપી યંત્રને ખોરાકરૂપી કોલસો પૂરો પાડવો જરૂરી છે. એ આહાર પોતે યજ્ઞ નહીં હોય તો પણ યજ્ઞ પાર પાડવાની ક્રિયાનું એક અંગ

છે. તેથી ‘આ ખાલી પેટ ભરવાપણું નથી, એને યજ્ઞકર્મ જાણ એમ આપણે કહીએ છીએ. બગીચામાંથી ફૂલ વીણી આણી ઈશ્વરને માથે ચડાવ્યાં તે પૂજા થઈ. પણ ફૂલ ઉગાડવાને માટે બગીચામાં જે મહેનત કરી તે પણ પૂજા જ છે. યજ્ઞ પૂરો પાર પાડવાને જે જે ક્રિયા કરવી જરૂરી છે તે એક -કારની પૂજા જ છે. દેહને આહાર આપીએ તો જ તે કામ આપે. યજ્ઞનાં સાધનરૂપી થનારાં કર્મો તે બધાં પણ યજ્ઞ જ છે. આ શરીર સેવાને માટે હંમેશ ખડું રહે તે માટે તેને હું જે આહુતિ આપું છું તે આહુતિ યજ્ઞરૂપ છે. સેવાર્થે કરેલો આહાર પવિત્ર છે.

આ બધી વાતોના મૂળમાં વળી શ્રદ્ધા જોઈએ. સર્વ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે, એવો ભાવ જોઈએ. આ ઘણી જ મહત્વની વાત છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ સિવાય સેવામયતા આવી શકતી નથી. ઈશ્વરાર્પણની આ -ધાન વસ્તુને વીસર્યે ચાલે તેમ નથી.

Bharat Joshi

Mob. 99250 47530

Bhumesh Joshi

Mob. 97129 51963

Ph. : 2764-234114



BALRAM

SALES CORPORATION

Authorised Dealers :

LPS & UNBRAKO MAKE HIGH TENSILE INDUSTRIAL FASTNERS, M.S., S.S. AND ALL TYPE OF NUTS & BOLTS

7, Sagar Com. Complex, Below Bank of Baroda, CHHATRAL.

Gujarat. Pin : 382729

E-mail : balramsales@gmail.com

કુર્યાત સદા મંગલમ્

કન્યા જોઈએ છે

નામ	: કૌશીકકુમાર દેવન્દ્રભાઈ વ્યાસ	ભાવિનભાઈ મધુ સુદન પુરોહિત	મૌલિક અરવિંદકુમાર પંડયા
જન્મ તારીખ	: ૭.૭.૧૯૮૬	૧૯.૪.૧૯૮૭	૧૬.૮.૧૯૮૫
અભ્યાસ	: ડિપ્લોમા -સીવીલ-	ડિપ્લોમા -નર્સીંગ	Master of Prof. Acct. & M.Com. (Finan.)
વ્યવસાય	: સરકારી નોકરી	નોકરી	આસી.મેનેજર (રીટેલ વુલવર્થ લિમિટેડ, પર્થ-ઓસ્ટ્રેલિયા)
માસિક આવક	: રૂ. ૧૩૦૦૦	રૂ. ૮૫૦૦	-
ઊંચાઈ	: ૫'.૭"	૫'.૧૧"	૧૭૨ સે.મી.
ગોત્ર	: ગર્ગ	પારાસર	કૌદન્યા
વતન	: -	રણાસણ	અમદાવાદ
રહેઠાણ	: મહાદેવગ્રામ -બાકરોલ (મોડાસા)	હાલ હિંમતનગર	-
સંપર્ક	: દેવેન્દ્રભાઈ વ્યાસ	મધુસુદન પુરોહિત	અરવિંદકુમાર પંડયા
	૯૩૭૪૯૬૯૯૦૧	૯૪૨૭૬૯૮૭૨૭	૨૬૭૬૪૩૭૨ / ૪૦૦૩૩૩૯૮
નામ	: હાર્દિક અરવિંદકુમાર પંડયા	પુરોહિત હર્ષિત	જોષી અલ્પેશ રાજેશકુમાર
જન્મ તારીખ	: ૧૨.૭.૮૪	૧૦.૪.૮૪	૧૩.૧૨.૧૯૮૬
અભ્યાસ	: બી.કોમ, AMFEE, IRDA	B.Sc. (Phy.), M.Sc. (Nano Tech.), Research in Apin Technology, Delhi	બીબીએ, એમબીએ
વ્યવસાય	: એડવાઈઝર ફાઈનાન્સ	આસી.મેનેજર (પંચમહાલ સ્ટીલ, હાલોલ)	અમદાવાદ ખાતે- કંપનીમાં
માસિક આવક	: -	-	રૂ.૧૫,૦૦૦
ઊંચાઈ	: ૫'.૯"	૫'.૧૦"	૫'.૯"
ગોત્ર	: કૌદન્યા	પારાસર	પારાસર
વતન	: અમદાવાદ	રણાસણ	વિજાપુર
રહેઠાણ	: અમદાવાદ	-	-
સંપર્ક	: અરવિંદકુમાર પંડયા	-કાશકુમાર	ગીતાબેન જોશી
	૨૬૭૬૪૩૭૨ અથવા ૪૦૦૩૩૩૯૮	૦૨૭૬૩-૨૨૨૯૭૨, મો. ૯૪૨૮૫૨૪૭૭	૦૨૭૬૩- ૨૨૩૧૯૯
નામ	: જોષી અમીતભાઈ વિષ્ણુ-સાદ	ગૌરાંગ દિલીપભાઈ ભટ્ટ	તમારી ચરબી જાતે માપો..(પાન ઝુનું શેષ)
જન્મ તારીખ	: ૨૧.૭.૧૯૮૪	૨૩.૧૦.૮૫	વજન અને ઊંચાઈ માપીને નોંધી લેવાં. (૩)
અભ્યાસ	: ધો.૧૨ પાસ, આઈટીઆઈ ડીઝલ-મીકેનિકલ	ડિપ્લોમા મીકેનિકલ, ડીગ્રી ચાલુ	દર મહિને વજન અને ઊંચાઈ માપવાં. (૪)
વ્યવસાય	: કિરણ મોટર્સ, હિંમતનગર મીકેનિક	એશિયન ટાઈલ્સ	ઊંચાઈમાં સામાન્ય રીતે એક સરખાપણું
માસિક આવક	: રૂ.૬૫૦૦	-	રહેશે, જ્યારે વજનમાં વધ-ઘટ થવાની
ઊંચાઈ	: ૫'.૫"	૫'.૯"	શક્યતા રહેશે. (૫) ખોરાકમાં એખ
ગોત્ર	: પારાસર	વચ્છસ	સરખાપણું હશે અને નિયમિત ચાલવું, કસરત
વતન	: રાયગઢ	રાયગઢ	કરવી વગેરે હશે તો વજન ઘટશે. (૬)
રહેઠાણ	: -	હિંમતનગર	લગભગ છ મહિના સુધી આ પ્રયોગ કરવાથી
સંપર્ક	: વિષ્ણુ-સાદ જોશી	દિલીપભાઈ ભટ્ટ	ખોરાક, કસરત અને ચાલવા બાબતે શું કરવું
	૦૨૭૭-૨૫૪૧૯૩, મો.૯૪૨૮૧ ૯૯૧૯૨	૯૪૦૮૫ ૮૫૭૯૦	તેનો અંદાજ આવી જશે. (૭) વજન વધે
			નહીં. તેની કાળજી રાખવાની રહે.

આપનું લવાજમ મનીઓર્ડર દ્વારા નીચેના સરનામે મોકલાવી શકશો.
બિપીનભાઈ સી. જોષી, પ્લોટ નં. ૫૧૭/૧, વાસ્તુનિર્માણ સોસાયટી, સેક્ટર-૨૧, ગાંધીનગર-૩૮૨૦૨૧

એકાવન શક્તિપીઠો-તેમની ઉત્પત્તિ, સ્થાન વિશેષ તથા મહત્વ



પ્રા. ભરતકુમાર ડી. ભટ્ટ, ગાંધીનગર

(ગતાંકથી આગળ)

આમ, એક દિવસ રામચંદ્રજી એક વૃદ્ધમુનિનો વેશ લઈને, લક્ષ્મણની સાથે, વૈષ્ણવીના નિવાસસ્થાને આવ્યા. આથી

તે તેમને ઓળખી શકી નહિ. રામ બોલ્યા : 'તું મને ઓળખી શકી નહિ. પરંતુ કલિયુગમાં જ્યારે હું કલ્કિ અવતાર ધારણ કરીશ ત્યારે હું તને મારી શક્તિ તરીકે સ્વીકારીશ. ત્યાં સુધી તું ઉત્તરમાં મૈનાક પર્વત ઉપર જઈને ત્રિકૂટ પર્વતની ગુફામાં જઈને તપશ્ચયા કર. ત્યાં લોકો આવીને તને પ્રણામ કરશે, અને તું આખા ભારતમાં પ્રસિધ્ધ થઈશ. ત્યાં તારે દુષ્ટ રાજા ભૈરવનો સંહાર કરવાનો રહેશે અને આખા વિશ્વમાં વૈષ્ણવ ધર્મનો પ્રચાર કરવાનો રહેશે.' તદ્દનુસાર વૈષ્ણવીદેવીએ ભૈરવનું મસ્તક પોતાના ચંદ્રથી છેદી નાખ્યું, જે ત્યાંથી ૩ કિ.મી. અંતરે જઈને પડ્યું, જ્યાં પાછળથી ભૈરવ મંદિર બનાવવામાં આવ્યું.

આ વૈષ્ણવી મંદિર જોકે શક્તિપીઠ નથી, છતાં પણ લાખો ભક્તો માટે યાત્રસ્થાન બની રહ્યું છે. આ સિવાય અન્ય સુપ્રસિધ્ધ શક્તિમંદિરોમાં ચામુંડા દેવીનું મંદિર, તુલજાભવાની દેવીનું મંદિર તથા નન્દાદેવીના મંદિરોનો સમાવેશ થાય છે.

ઉપસંહાર :

મહાકવિ કાલિદાસે યોગ્ય જ કહ્યું છે કે સમગ્ર જગતનાં માતા-પિતા એવા પાર્વતી તથા પરમેશ્વરને હું પ્રણામ કરું છું. બ્રહ્મા-વિષ્ણુ-મહેશની ત્રિમૂર્તિમાં શિવજીને સૌથી મહાનદેવ ગણવામાં આવે છે. તે જ પ્રમાણે પાર્વતી અથવા શિવની પત્ની સતી સૌથી મહાન દેવીમાતા છે. ભારતમાંના ૧૧ શક્તિપીઠો એ શક્તિસ્થાનિકો છે કે જે શક્તિમાતા પ્રત્યે ભક્તોની શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિનાં કેન્દ્રો છે. યજ્ઞના અગ્નિમાં સતીના આત્મવિલોપનનો કરુણ પ્રસંગ તથા વિષ્ણુ ભગવાન દ્વારા સતીનાં અંગોના ટુકડા કરીને ભારતમાં વિભિન્ન સ્થળે ફેંકવાની ઘટના એક છૂપા આર્શીવાદ નિર્માણ માટે કારણભૂત બની રહી. માતાજી ભક્તોના સુખી, સ્વાસ્થ્યપૂર્ણ અને દીર્ઘ આયુષ્ય માટે કૃપા વરસાવતાં રહે તેવી અભ્યર્થના ! (સંપૂર્ણ)

ભટ્ટમેવાડા વર્તમાનના અંકો દર માસની ૧૫ તારીખે રવાના કરવામાં આવે છે જે મોડામાં મોડા ૨૫ તારીખ સુધીમાં સામાન્ય રીતે મળી જતા હોય છે. કોઈ કારણસર જો અંક ન મળે તો પત્ર દ્વારા શ્રી રમેશભાઈ જોશી, પ્લોટ નં. ૧૩૧૬/એ-૨, સેક્ટર-૨૮૨ ૦૦૭ડી, ગાંધીનગરના સરનામે અથવા ફોન નં. (૦૭૯) ૨૩૨૩૦૬૩૨ પર જણાવવા વિનંતી છે કે જેથી જે જ્ઞાતિજનોને અંક ન મળ્યો હોય તેમને મોકલવાની વ્યવસ્થા થઈ શકે.

સમસ્ત ભટ્ટમેવાડા પરિવાર કલ્યાણ (બીમારી) સહાય યોજના

સમાજના ષષ્ઠમ સંમેલનમાં નક્કી થયા મુજબ સમસ્ત ભટ્ટમેવાડા પરિવાર કલ્યાણ (બિમારી)સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજનામાં જોડાવાની મુદત જ્ઞાતિજનોની માંગણીને ધ્યાને લઈ ૩૧.૫.૨૦૧૧ સુધી લંબાવવામાં આવેલ છે. આ યોજનામાં જોડાવા માટે સમસ્ત ભટ્ટમેવાડા પરિવાર કલ્યાણ (બીમારી) સહાય યોજનાના નામનો ચેક મોકલવા વિનંતી છે. બહારગામનો ચેક હોય તો રૂ.૫૦ વધુ મોકલવા.

ઉપરોક્ત બંને યોજનાઓ માટે ઘણા જ્ઞાતિજનોની પૃચ્છા આવે છે કે આ યોજનામાં દાખલ થયેલ વ્યક્તિ ના ૭૦ કે ૬૦ વર્ષ પુરા થાય પછી તે સભ્ય તરીકે ચાલુ રહે કે કેમ?

આ અંગે સ્પષ્ટતા કરવાની કે ૭૦ અથવા ૬૦ વર્ષ ની ઉંમર દાખલ થવા માટે છે . એક વખત સભ્ય બન્યા પછી તે વ્યક્તિ આજીવન સભ્ય તરીકે ચાલુ રહે છે . મૃત્યુ યોજના માં દાખલ થવાની વધુમાં વધુ ઉંમર ૭૦ વર્ષ છે જ્યારે બિમારી માં ૬૦ વર્ષ છે.



LIC

ભારતીય જીવન बीमा निगम
LIFE INSURANCE CORPORATION OF INDIA

With Best Compliments From

Sonu N. Bhatt

(AGENT)

**NSC, KVP, MIS, R.D.,
SMALL SAVINGS SCHEME,
LIC, UTI, PPF, COS. DEPOSITS,
SRGE, ICICI MUTUAL FUND,
RBI RELIEF BONDS.**

: RESIDENCE :

PLOT NO. 152/2, ANAND VATIKA SOCIETY,
SECTOR-22, GANDHINAGAR-382022.
PH. : 079-23227798, (M) 98980 27798

સમસ્ત ભટ્ટમેવાડા જનની વિગતો આવરી લેતી સમાજની ડીરેક્ટરી તૈયાર

જય એકલીગજ સાથે જણાવવાનું કે, હાલના ૨૧ સદીના ઝડપી જમાનામાં સંપર્ક ખૂબ જ અગત્યની બાબત છે. હાલમાં આપણે આપણા ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ જોઈ શકીએ છીએ, દેશ-વિદેશમાં વાતચીત કરી શકીએ છીએ. એટલે કે સંપર્ક ખૂબ જ ઝડપી બન્યો છે. આ સંપર્કો વધુ ગાઢ બને, સમાજના ભાઈઓ એકબીજાની વધુ નજીક આવે, અન્ય શહેરોમાં વસતા જ્ઞાતિજનનોની માહિતી મળી રહે તે માટે સમાજની ડીરેક્ટરી બનાવવાનું કામ ગાંધીનગર સમાજે શરૂ કરેલ હતું તે કામ હવે પૂર્ણતાને આરે છે અને ડીરેક્ટરી મે માસના આખર સુધી માં પુર્ણ કરવામાં આવશે. હાલમાં ડીરેક્ટરી સીડી સ્વરૂપે આપવામાં આવશે અને તેમાં કોઈ સુધારા/વધારા કરવાના થતા હશે તો તે કરીને નીટ કરાવવામાં આવશે. ડીરેક્ટરી ની સોફ્ટ કોપી મેળવવા માટે પોતાનું ઈમેલ સરનામું શ્રી રમેશભાઈ જોશીને તેમના rmjoshi51@yahoo.com ના સરનામે મોકલવા વિનંતિ છે

જે જ્ઞાતિજનોએ ડીરેક્ટરીના ફોર્મ ન ભર્યા હોય તેમને વહેલીતકે ભરી દેવા વિનંતી છે કે જેથી ડીરેક્ટરી નીટ થાય તે પહેલાં તેમની વિગતોનો સમાવેશ થઈ શકે.

With Best Compliments From

Ritesh Mehta (M.Com.)

(M) 98240 49997

Ph. : 241 7379

Chandan Distributors

Surgical Products and Rehabilitation
Aid Vissco, Flamingo, Accuchek,
Diamond, Omron Hicks

Vadi Wadi, Behind Shiyapura Police Chowkey,
Near Tower Raopura, Vadodara - 390 001.
E-mail : chandsurgi@yahoo.com

Ramesh Mehta

(M) 98240 14997

Mehta Associats

LAND DEVELOPERS &
PROJECT CONSULTANT

B/h. Shiyapura Police Chowkey,
Vadi Wadi, Raopura Tower,
Vadodara - 390 001.

Tele No. (0265) 2413157 Fax : (0265) 2417379

E-mail : mehtaprocon@yahoo.co.in

પુજ્ય એકલીગજ દાદાનો પાટોત્સવ વડોદરા, પાલ્લા, સુરત ખાતે ઉજવાયો

વડોદરા ખાતે શ્રી ભટ્ટમેવાડા એકલીગજ મહાદેવ ઉત્સવ મંડળ દ્વારા તા.૨.૪.૨૦૧૧ ના રોજ પુજ્ય એકલીગજ દાદાનો પાટોત્સવ ઉજવાઈ ગયો જેનો અહેવાલ મંડળના ખયાનથી શ્રી બલભદ્રભાઈ ગોરે મોકલેલ છે. લઘુરુદ્ર પુજાના યજમાન તરીકે બડોલીના વતની શ્રી કીર્તિકુમાર વિશ્વનાથ આચાર્ય નો પરિવાઈ હતો. લઘુરુદ્ર પુજા બાદ સભા રાખવામાં આવેલ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મહેશભાઈ બી.ઉપાધ્યાય હાજર રહ્યા હતા. સભા દરમ્યાન વેશભુષા હરીફાઈ, સંગીત ખુરશીની હરિફાઈ વગેરે રકમો રમાડવામાં આવેલ હતી. વિજેતા ભાઈ-બહેનોને શ્રી અશોકભાઈ પંડ્યા તરફથી ઈનામો આપવામાં આવેલ હતા

પાલ્લા ખાતે પણ એકલીગજ દાદાનો સાતમો પાટોત્સવ યોજાઈ ગયો.

લઘુરુદ્ર પુજન અને દાદાની -તિમા સાથેની શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી અને વડોલોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલ હતું. પુજન અને -સાદના દાતા તરીકે શ્રી જીતેન્દ્રકુમાર એ.સ.પંડ્યા (મુંબઈ) હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજના -મુખ શ્રી -કાશભાઈ જોશીએ કાર્યક્રમનું સંચાલન કરેલ હતું.

સુરત ખાતે પણ સમસ્ત ધાણધાર ભટ્ટમેવાડા, બનાસકાંઠાના વતની અને છેલ્લા ૩૦ વર્ષથી સુરત ખાતે સ્થાયી થયેલા જ્ઞાતિજનોએ પુજ્ય દાદાનો પાટોત્સવ સમગ્ર ભટ્ટમેવાડા જ્ઞાતિના પરિવારના કલ્યાણ, -ગતિ, બાળકોની ઉચ્ચ કેળવણી અને દીર્ઘ આયુષ્ય માટે ઉત્સાહપૂર્વક ઉજવેલ હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ જોશી અને વસંતભાઈ જોશીએ કરેલ હતું.

ભટ્ટમેવાડા રોજગાર માહિતી કેન્દ્ર - માહિતી ન મોકલી હોય તો તાત્કાલિક મોકલવા વિનંતી

જ્ઞાતિના નોકરી વાંચુ યુવક-યુવતીઓને તેમનો બાયોડેટા મોકલી આપવા માટે ભટ્ટમેવાડા વર્તમાનના એન્લિ માસના અંકમાં વિનંતી કરવામાં આવેલ હતી. નજીકના ભવિષ્યમાં નોકરીની ઉભી થનાર તકોને ધ્યાને લેતાં જેઓએ બાયોડેટા મોકલેલ નથી તેઓને વહેલીતકે બાયોડેટા મોકલી આપવા ફરીથી વિનંતી છે.

જોબમાર્કેટમાં-નોકરીવારંધું યુવા વર્ગ માટે ખુશીના સમાચાર

બેકો ૨૦૧૩ની સાલ સુધીમાં
બે લાખની ભરતી કરશે
ભટ્ટમેવાડા યુવક-યુવતીઓ અત્યારથી
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા
વિનંતી – માગદર્શન માટે ગાંધીનગર
ખાતેથી થશે વ્યવસ્થા

નોકરી મેળવવા છે. જાહેર ક્ષેત્રની સૌથી
માંગતા યુવક-યુવકતીઓ મોટી બેક ૩૩૦૦૦ જેટલા
માટે ખૂબ જ સારા સમાચાર કર્મચત્તારીઓની ભરતી
છે. આગામી દિવસોમાં કરવાની યોજના ધરાવે છે.
જાહેરક્ષેત્રની (સરકારી) આ ઉપરાંત બેક ઓફ
બેકો મોટાપાયે ભરતી ઈન્ડિયા,, પંજાબ નેશનલ
કરવાની તૈયારીમાં છે અને બેક, સેન્ટ્રલ બેક વગેરેમાં
તેથી જોબમાર્કેટમાં તેજનો ભરતીની મોટી યોજના છે.
રણકાર થવાની સંભાવના હાલમાં બેકો મોટાપાયે સ્ટાફ
છે. કટોકટીનો સામનો કરી

આગામી વર્ષોમાં રહેલ છે. એક અંદાજ
બેકોને હજારો મુજબ આગામી બે વર્ષમાં
કર્મચારીઓની જરૂર બેકોના અડધાથી વધુ
પડનાર છે. જુદા જુદા કર્મચારીઓ નિવૃત્ત થનાર
પરિબળોના પરિણામે છે. જેથી ગ્રાહકોને અપાતી
સ્વરુપ બેકોમાં કલાર્ક, સેવાઓને અસર ન થાય તે
ઓફિસર વગેરેની બે માટે મોટાપાયે ભરતી
લાખથી વધુની ભરતી કરાશે.
કરવાની યોજના તૈયાર થઈ
રહી છે.

ટૂંક સમયમાં ભટ્ટમેવાડા યુવક-
કર્મચારીઓની નિવૃત્તિ, નવી યુવતીઓને ખાસ વિનંતી છે
શાખાઓ ખોલવી, વગેરેને કે આગામી સમયમાં આ
કારણો સ્ટાફની સમસ્યા ખાલી પડનાર જગ્યાઓ
ઉભી થનાર છે. આ માટે અત્યારથી જ તૈયારી
સમસ્યાને દૂર કરવા બેકો શરૂ કરે. માર્ગદર્શન અને
ઝડપથી આગળ વધી રહી થાલિમ માટે જરૂર જણાયે
થઈ શકશે. સમાજ તરફથી વ્યવસ્થા

ૐ લીંગમૂર્ત્યે

વિઘ્નહે,

પંચમુખાય ધીમહી તત્તો
એકલિંગજી પ્રયોદયાત્



જય એકલિંગજી નમઃ શિવાય, જય એકલિંગજી નમઃશિવાય
મંગલકારી શીવનું નામ, જય એકલિંગજી નમઃશિવાય
દર્શન કરતાં ધોવાય પાપ, જય એકલિંગજી નમઃશિવાય
સાયું સુખ દેનારૂ નામ, જય એકલિંગજી નમઃશિવાય
વિશ્વ સકળના તારણ હાર, જય એકલિંગજી નમઃશિવાય
વાંચ્છીત ફળ દેનારૂ નામ, જય એકલિંગજી નમઃશિવાય
જન્મ-મરણના દુઃખ હરનાર, જય એકલિંગજી નમઃશિવાય
કલ્યાણકારી એક જ નામ, જય એકલિંગજી નમઃશિવાય
ચરણોમાં જેના અડસઠ ધામ, જય એકલિંગજી નમઃશિવાય
મેવાડના રાજાધિરાજ, જય એકલિંગજી નમઃશિવાય
ભટ્ટમેવાડાના જીવન આધાર, જય એકલિંગજી નમઃશિવાય
વંદે ભટ્ટમેવાડા બાળ તમામ, જય એકલિંગજી નમઃશિવાય
કરૂણાનિધાન અનુબલના નાથ, જય એકલિંગજી નમઃશિવાય
જય એકલિંગજી નમઃ શિવાય, જય એકલિંગજી નમઃશિવાય

- બલભદ્ર જે. ગોર (ભાતૃજ), વડોદરા

ફ્લાફ્લના નામે કુદરતી કુટ, જયુસ વગેરે આરોગ્ય-દ
વસ્તુઓની જ્ઞાતિજન તરફથી થયેલ વ્યવસાયિક શરૂઆત

મુળ ઓઢાના વતની અને તાજેતરમાં જ અમદાવાદમાં
સ્થાયી થયેલ શ્રી કીરીટભાઈ ઉપધ્યાયે અમદાવાદ ખાતે યોગી
કોમ્પલેક્ષ, ડ્રાઈવ-ઈન સિનેમા પાસે ફ્લાફ્લ નામની
વ્યવસાયિક પ્રતિષ્ઠાન શરૂ કરેલ છે. જેમાં આજના સમયની
આરોગ્યની જાળવણી માટે ખાસ જરૂરી એવી નેચરલ કુટ,
કુટની ડીશ, જયુસ વગેરે મળે છે. પુજ્ય એકલીંગજી દાદાની
અસીમ કૃપા તેમના પર ઉતરે તેવી અભ્યર્થના અને તેમનો ધંધો
વિકસે, કુલુફાલે તેવી શુભેચ્છા.